

29 જૂન 2018

બ્રમ્પટન સોકર સેંટર બદલાઈ રહ્યું છે

બ્રમ્પટન, ઓન્ટારિયો – બ્રમ્પટન સોકર સેંટર (Brampton Soccer Centre) એક ઈન્ડોર/આઉટડોર મલ્ટિ-સ્પોર્ટ્સ ફેસિલિટીનું રૂપ લઈ રહ્યું છે. હાલમાં અનેક નવીનીકરણો ચાલી રહ્યા છે અને આગામી વર્ષે આઉટડોર મેદાનોના ઉપયોગનો વિસ્તાર કરવા માટે નવું ડોમ અને બે ટર્ફ ફિલ્ડ બનાવવાની યોજના છે. સેંટર ખાતે જુલાઈ 9ના રોજ સાંજે થી 8 વાગ્યે વધુ જાણકારી મેળવવા માટે જાહેર માહિતી સત્ર હાથ ધરવામાં આવી રહ્યું છે જેમાં રસ ધરાવતા રહીશોને આમંત્રણ છે.

ઈન્ડોર નવીનીકરણ

ગત થોડા વર્ષોમાં વિવિધ રમતોની લોકપ્રિયતા સ્થાનાંતરિત થઈ છે, શહેરમાં જિમ્નેશિયમની એટલેકે વ્યાયામશાળાની જગ્યા માટે વધતી જતી માંગ છે. ફિલ્ડહાઉસ ડી જે ઘણી વખત હંગામી વ્યાયામશાળા તરીકે વાપરવામાં આવે છે તેમાં તાજેતરમાં એક નવો માળ ઉમેરીને અર્ધ-કાયમી વ્યાયામશાળા એટલેકે જિમ્નેશિયમમાં રૂપાંતરિત કરવામાં આવ્યું છે.

જમના નવા ફ્લોરમાં સપાટીની ગુણવત્તામાં સુધારો થશે અને આ સ્થળે રમી શકાય એવા રમતોના પ્રકારોમાં વધારો થશે જેને કારણે ટૂર્નામેન્ટો અને અન્ય ઈવેન્ટ્સ માટેના વેન્યુનો એક વધારાનો વિકલ્પ ઊભો થશે. નવું ફ્લોરિંગ તેમ છતાં આવશ્યક હશે તો કોઈ મહત્વના રમતગમતના ઈવેન્ટ માટે દૂર કરી શકાયે તેવું હશે.

આઉટડોર નવીનીકરણ

આખું વર્ષ ઉપયોગ કરી શકાય તે માટે એક ફિલ્ડ એટલેકે મેદાન પર એક નવું વેધર-પ્રૂફ ડોમ બનાવવામાં આવશે. ડોમ દર વર્ષે નવેમ્બરથી એપ્રિલ ફિલ્ડને આવરી લેશે. ડોમની પાસે જ એક નાનું મકાન બનાવાશે જેમાં પ્લેયરોને શૌચાલય અને ચેન્જરૂમની સવલતો પૂરી પાડશે. પાડોશમાં રહેલ રહેઠાણો પર ઓછામાં ઓછી અસર થાય તે માટે ડોમ તે ફિલ્ડ પર બનાવવામાં આવશે જે રહેઠાણ ધરાવતા ઘરોથી સર્વાધિક દૂર હોય.

વધુમાં, ફિલ્ડ દરેક પ્રકારની રમતો માટે ઉચિત ઠરે, તે રમવાની ઋતુ વિસ્તારી શકાય અને વરસાદને કારણે બંધ કરવાના બનાવો ઘટાડવા માટે બે આઉટડોર ફિલ્ડ લાઈટ્સ સાથે બનાવટી ટર્ફમાં રૂપાંતરિત કરવામાં આવી રહ્યા છે.

બાંધકામ પૂર્ણ થશે ત્યારે સવલતનું નામ બદલીને "બ્રમ્પટન સ્પોર્ટ્સ સેંટર" કરાશે જે સેંટરના ઘણી બધી રમતોના ઉપયોગને પ્રતિબિંબિત કરશે.

ક્વોટ:

"રહીશો અને વપરાશકર્તા જૂથોએ પાર્ક્સ એન્ડ રિક્રિએશન માસ્ટર પ્લાનના વિકાસ અવકાશને અમને જાણાવ્યું હતું કે અમારે શહેર ફરતે મળતી સ્પોર્ટ્સની સવલતોનું વૈવિધ્ય વધારવું જોઈએ. બ્રમ્પટન સોફ્ટ સેન્ટર ખાતેના નવીનીકરણ આ સ્થળે રમતોના વધુ વિકલ્પો પૂરા પાડશે જેથી સમુદાયની સેવા વધુ સારી રીતે થાય અને જેનાથી એક સક્રિય, આરોગ્યપ્રદ જીવનશૈલી ઊભી કરવામાં મદદ મળે".

- મેયર વિન્ડા જેફી

-30-

બ્રમ્પટન વિશાળ આયોજનો વિષે વિચારે છે. અમે તીક્ષ્ણ ફોકસ ધરાવતું ભવિષ્ય માટે તૈયાર સંગઠન છીએ. અમે જાણીએ છીએ કે આપણા સમુદાયની વૃદ્ધિ, યુવાની અને વૈવિધ્ય આપણને અલગ ઓળખ પ્રદાન કરે છે. અમે કનેડાના ઈનોવેશન સુપર કોરિડોર ખાતે સ્થિત છીએ જ્યાં રોકાણોને પ્રોત્સાહિત કરીએ છીએ અને વૈશ્વિક સ્તરે અમારી સફળતામાં વૃદ્ધિ કરી રહ્યા છીએ. અમે બનાવી રહ્યા છીએ એવા ગતિશીલ શહેરી કેન્દ્રો જે તકોનો તણખો ચાંપે છે અને અહીં કામ કરતા લોકોમાં ગૌરવની લાગણીનો સંચાર કરે છે. અમે બ્રમ્પટનને આગળ ધપાવી રહ્યા છીએ જેથી તે એક જોડાણ ધરાવતું શહેર બને જે પ્રવર્તનાત્મક, વ્યાપક અને સાહસિક હોય. અમને [Twitter](https://twitter.com/brampton) અને [Facebook](https://www.facebook.com/brampton) પર ફોલો કરો. અહીં વધુ જાણકારી મેળવો www.brampton.ca.